



ગુજરાત જાહેર સેવા આયોગ

અગત્યની જાહેરાત

(જા. ક. ૬૯ થી ૯૪/૧૬-૧૭ માં યુજીસી રેગ્યુલેશન, ૨૦૦૯ મુજબની પી. એચ. ડી ની પદવી બાબત)

આયોગ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાનની કોલેજો ખાતેના વિવિધ વિષયના મદદનીશ પ્રાધ્યાપકોની જાહેરાતોમાં સદરહુ જાહેરાતોના ભરતી નિયમો મુજબ શૈક્ષણિક લાયકાત તરીકે અનુસ્નાતક કક્ષાએ લઘુત્તમ ૫૫% કે સમકક્ષ ગ્રેડ તથા NET / SLET/ SET ની પરીક્ષા ઉત્તિર્ણ કરેલી હોવી જોઈએ તેવી જોગવાઈ છે. જે ઉમેદવારો સંબંધિત વિદ્યાશાખામાં University Grants Commission (minimum Standards and Procedure for Award of Ph.D. Degree) Regulation, 2009 મુજબની Ph.D. પદવી ધરાવે છે તેઓને NET / SLET/ SET ની પરીક્ષા ઉત્તિર્ણ કરવામાંથી મુક્તિ મળવાપાત્ર છે. તે મુજબનો ઉલ્લેખ આ જગ્યાઓની જાહેરાતની જોગવાઈઓમાં પણ સ્પષ્ટપણે કરવામાં આવેલ હોવા છતાં ઉક્ત જાહેરાતોમાં પ્રાથમિક કસોટીમાં સફળ ઉમેદવારોની અરજીઓની ચકાસણી કરતા આયોગના ધ્યાને આવેલ છે કે કેટલાક ઉમેદવારોએ NET / SLET/ SET ની પરીક્ષા ઉત્તિર્ણ કરેલ નથી તથા તેઓની Ph.D. ની પદવી અંગેના યુનિવર્સિટીના સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ નોટીફિકેશન કે પ્રમાણપત્રમાં આ પદવી UGC Regulation, 2009 મુજબની હોવા અંગેનો ઉલ્લેખ નથી. તેથી આવા પ્રમાણપત્રો રજૂ ન કરવાને કારણે અને ઉમેદવારોના પક્ષે બીનકાળજીના કારણોસર આયોગ દ્વારા જાહેરાતમાં જણાવ્યા મુજબ તબક્કાવાર કાર્યક્રમના અમલમાં વિલંબ થઈ રહેલ છે.

તેથી, ઉમેદવારોના વિશાળ હિતને ધ્યાને લઈ અને કોઈ લાયક અને પાત્ર ઉમેદવારને આ પ્રમાણપત્ર રજૂ ન કરવાના કારણે અન્યાય ન થાય તે હેતુથી આવા ઉમેદવારોને છેલ્લી તક રૂપે તા.૧૫/૧૧/૨૦૧૭ સુધીમાં કચેરી સમય દરમિયાન ઉપર જણાવ્યા મુજબનું પ્રમાણપત્ર આયોગની કચેરી ખાતે મોકલી આપવા અથવા રૂબરૂમાં રજૂ કરવા જણાવવામાં આવે છે, અન્યથા આયોગ દ્વારા તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.

નોંધ: જે ઉમેદવારોના Ph.D. ની પદવીના નોટીફિકેશન કે પ્રમાણપત્રમાં તેઓની આ પદવી UGC Regulation, 2009 મુજબની હોવા અંગેનો ઉલ્લેખ છે તેઓએ ફરીથી આ બાબતે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેતું નથી.

તા. ૦૨/૧૧/૨૦૧૭